

Unit Linked Partial Withdrawal Form

યુનિટ લિંક પાર્શિયલ
વિથદ્રોઅલ ફોર્મ

For Office Use Only

ફક્ત કાર્યાલયના ઉપયોગ માટે

Branch:

શાખા:

Receipt Date & Time:

રસીદની તારીખ અને સમય:

Received by:

પ્રાપ્તકર્તા:

Interaction ID:

ઈન્ટરેક્શન આઈડી:

Current Day NAV

વર્તમાન દિવસનું એનએવી

Next Day NAV

બાદના દિવસનું એનએવી

Existing KYC

હાલનું કેવાયસી

Fresh KYC

નવું કેવાયસી

Employee Code:

કર્મચારી કોડ:

Signature:

સહી:

Branch
Stamp

શાખાનું
સ્ટેમ્પ

**HDFC
Life**
Sar utha ke jiyo!



Do you really need to withdraw funds from your life insurance policy?

શું તમારે ખરેખર તમારા લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીમાંથી ફંડ પાછું
ખેંચવાની જરૂર છે ?

We would like you to take a well-informed decision with regard to the partial withdrawal from your life insurance policy. Help us help you by sharing the reason for partial withdrawal. Please select from any of the options given below:

અમે ઇચ્છીએ છીએ કે તમે તમારી લાઈફ ઇન્શ્યુરન્સ પોલિસીમાંથી પાર્શિયલ વિથદ્રોઅલ સંદર્ભે એક સારી રીતે સમજીને નિર્ણય લો. પાર્શિયલ વિથદ્રોઅલના કારણને શેર કરીને તમારી સહાય કરવામાં અમારી સહાય કરો. કૃપયા નીચે આપેલા કોઈપણ વિકલ્પોમાંથી પસંદ કરો:

- ☐ Advice by HDFC Life Financial Consultant એચડીએફસી લાઈફ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટની સલાહથી
☐ Advice by Bank Employee / Broker બેંક કર્મચારી/બ્રોકરની સલાહથી
☐ Advice by HDFC Life Employee એચડીએફસી લાઈફ કર્મચારીની સલાહથી

Name _____ & Contact No. _____ of the above mentioned person, if available.

ઉપરોક્ત ઉલ્લેખિત વ્યક્તિનું નામ _____ અને સંપર્ક નં. _____, જો ઉપલબ્ધ હોય.

- ☐ Child's education બાળકનું ભણતર
☐ Wedding/family function બાળકનું ભણતર
☐ Buy another product from HDFC Life એચડીએફસી લાઈફમાંથી બીજું પ્રોડક્ટ ખરીદવા
☐ Buy gold/silver સોનું/ચાંદી ખરીદવા
☐ Buy a vehicle વાહન ખરીદવા
☐ Invest in real estate સ્થાવર મિલકતમાં રોકાણ કરવા
☐ Re-invest in other financial instruments અન્ય નાણાકીય સાધનોમાં ફરીથી રોકાણ કરવા
☐ Others (Please specify): _____ અન્ય (કૃપયા સ્પષ્ટ કરો): _____

Please ask yourself the following questions before filling up the form.

કૃપયા ફોર્મ ભરતા પૂર્વે તમે પોતાને જ નીચેના પ્રશ્નો પૂછો.



Are you ready to reduce your cover on Life or old age pension?

શું તમે જીવન અથવા વૃદ્ધાવસ્થા પેન્શન પરના તમારા કવરને ઘટાડવા માટે તૈયાર છો?

- As per a survey, life expectancy of an average Indian is 68 years*. એક સર્વેના આધારે સરેરાશ ભારતીયનું આયુષ્ય 68 વર્ષનું હોય છે*.
- This means that there is a need to have sufficient funds at the time of retirement to ensure a self-dependent future. આનો અર્થ એ કે સ્વનિર્ભર ભાવિને સુનિશ્ચિત કરવા નિવૃત્તિ સમયે પૂરતા ફંડની આવશ્યકતા હોય છે.
- If you have partially withdrawn from your funds or reduced the premium, you are requested to stay insured by paying your policy premium. In case you fail to do so, your policy status will change and it may result in your policy getting paid up/cancelled and all benefits/risk cover may accordingly cease to exist. Please refer to your policy document for details.

*Source: World Bank

<https://data.worldbank.org/indicator/SP.DYN.LE00.IN>

જો તમે તમારા ફંડમાંથી આંશિક ઉપાડ કર્યું હોય અથવા પ્રીમિયમનો ઘટાડો કર્યો હોય, તો તમને તમારા પોલિસી પ્રીમિયમની ચુકવણી દ્વારા વીમાકૃત રહેવાની વિનંતી છે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહો છો, તો તમારી પોલિસીની સ્થિતિ બદલાય જશે અને તે તમારી પોલિસી પેડ-અપ/રદ થશે અને બધા લાભ/રીસ્ક કવર તે મુજબ સમાપ્ત થઈ શકે છે. કૃપયા વિગતો માટે તમારી પોલિસીના દસ્તાવેજનો સંદર્ભ લો.

*સ્ત્રોત: વર્લ્ડ બેંક

<https://data.worldbank.org/indicator/SP.DYN.LE00.IN>



Are you compromising on your long term goals or your family's financial security?

શું તમે તમારા લાંબા ગાળાના લક્ષ્યો અથવા તમે તમારા કુટુંબની નાણાકીય સલામતી સાથે સમાધાન કરી રહ્યા છો?

- Higher education, wedding, contingency planning are some events that need you to stay insured for a longer period. You will be able to meet your long term expenses better only if you remain insured till the end of the policy term and allow your corpus to keep growing. ઉચ્ચ શિક્ષણ, લગ્ન, અનિશ્ચિતતા માટેના આયોજન જેવી કેટલીક ઘટનાઓ છે જેના માટે તમારે લાંબા ગાળા સુધી વીમાકૃત રહેવાની જરૂર પડે છે. જો તમે પોલિસી અવધિની સમાપ્તિ સુધી વીમાકૃત રહો છો અને તમારા કોર્પસને વધતું રહેવાની મંજૂરી આપો છો તો જ તમે તમારા લાંબા ગાળાના ખર્ચને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો.
- Remember, wealth accumulation happens only through saving more, saving regularly and allowing optimum growth of your funds. યાદ રાખો, ફક્ત વધુ અને નિયમિત બચત કરવાથી અને તમારા ફંડમાં મહત્તમ વૃદ્ધિ થવાની મંજૂરી આપવાથી સંપત્તિનો સંચય થાય છે.

માહિતી મેમોરેન્ડમ સામાન્ય પ્રકારનું છે અને પોલિસીહોલ્ડરના સામાન્ય હિતમાં ચલણમાં મૂકવામાં આવે છે. કૃપયા કોઈપણ નિર્ણય લેતા પહેલાં પોલિસીના દસ્તાવેજનો સંદર્ભ લો.

[illegible]

પેન (પર્મનન્ટ અકાઉન્ટ નંબર) (યુએલ યંગ સ્ટાર અને ચિલ્ડ્રન્સ પ્લાનોની બાબતમાં, જો લાભાર્થી પુખ્ત વયનું હોય, તો લાભાર્થીની વિગતો પ્રદાન કરો જેથી કરીને તેના પ્રમાણે તેના માટે ટીડીએસની કપાત કરી શકાય).

Contact * No.: (Off) _____ / (Res) _____ / (Mob) _____ (Mobile number is preferable)
 સંપર્ક* નં.: (ઓફિસ) _____ / (રહેઠાણ) _____ / (મોબાઈલ) _____ (મોબાઈલ નંબરને પ્રાધાન્ય
 આપવા આવે છે)

*અમે તમારા દ્વારા પ્રદાન કરેલી સંપર્ક વિગતો ભવિષ્યના તમામ સંદેશવ્યવહાર માટે ઉપયોગ કરીશું અને આને તમારી સાથે સંપર્ક કરવાની સંમતિ તરીકે ગણવામાં આવશે.

****પોલિસીની જોગવાઈ અનુસાર આંશિક ઉપાડ માટેનો શુલ્ક અને કરો અને શુલ્કો (જો આ આની સાથે સુસંગત હોય તો) લાગુ પડે છે.**

સરંડર રિવર્સલ માટે પ્રાપ્ત આ પાર્શિયલ વિથડ્રોઅલની વિનંતી સરંડરની તારીખથી ૩૦ દિવસની અંદર છે

ન્યુચેલ યંગ સ્ટાર અને ચિલ્ડ્રન'સ પ્લાનોની બાબતમાં, જો લાભાર્થી પુખ્ત વયનું હોય તો તેના/તેણીના પુરાવા પ્રદાન કરો. જો વીમાકૃત વ્યક્તિ હવે જીવિત નથી અને લાભાર્થી સગીર છે, તો નિમાચેલ વ્યક્તિના પુરાવાની પણ જરૂર છે.

આવકવેરા કાયદા, 1961 ની જોગવાઈઓ અનુસાર જીવન વીમા પોલિસી હેઠળ કરવામાં આવતી ચુકવણીઓમાંથી, જો લાગુ પડે, તો સોત પર કરવેરો કપાત કરવામાં આવશે. કરવેરા કાયદામાં સમયે સમયે ફેરફારો થઈ શકે છે.

હં પુષ્ટિ કરું છું કે આ અરજી કરતાં પહેલા તમામ સંબંધિત પોલિસીની જોગવાઈઓ વાંચી અને તેમને અને તેના પરિણામો સમજી લીધા છે.

અસાઇન કરેલી પોલિસીઓના કિસ્સામાં અસાઇનનીની વિગતો આવશ્યક છે

Signature of Policyholder/Assignee
પોલિસીહોલ્ડર/અસાઈનીની સહી


Page 2-5

Bank Account No.:
બેંક ખાતા નં.:

Account Holder Name: _____
ખાતા ધારકનું નામ:

Bank Name & Branch: _____
બેંકનું નામ અને શાખા:

Account Type: ☐ Savings ☐ Current ☐ NRO ☐ NRE
ખાતાનો પ્રકાર: બચત ચાલુ એનઆરઓ એનઆરઇ



*All premium(s) paid from NRE Account: ☐ ** Proportionate premium(s) paid from NRE Account: ☐
*એનઆરઇ ખાતામાંથી ચૂકવવામાં આવેલા તમામ પ્રીમિયમ: **એનઆરઇ ખાતામાંથી ચૂકવવામાં આવેલા પ્રમાણસર પ્રીમિયમ:

IFSC^:
આઇએફએસસી^:

^11 character code appearing on your cheque leaf
^11 અક્ષરનો કોડ તમારા ચેકના પાના પર દેખાય છે

*Refund to NRE account (full or proportionate) will be subject to ratio of premium(s) paid through NRE account. Please submit a bank statement or bank confirmation letter as an evidence for premium(s) paid through NRE account.

**In case of proportionate payout, please provide two NEFT mandates i.e. for NRE account and non-NRE account.

*એનઆરઇ ખાતામાં રિફંડ (સંપૂર્ણ અથવા પ્રમાણસર) એનઆરઇ ખાતા દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમ ના ગુણોત્તરને આધીન રહેશે. કૃપયા એનઆરઇ ખાતા દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમ ના પુરાવા રૂપે બેંક સ્ટેટમેન્ટ અથવા બેંક કન્ફિરમેશન લેટર સબમિટ કરો.

**પ્રમાણસર ચૂકવણીના કિસ્સામાં, કૃપયા એનઆરઇ ખાતા અને બિન-એનઆરઇ ખાતા માટે બે એનઇએફટી મેન્ડેટ્સ પ્રદાન કરો.

Tax declaration for the current financial year (except for Excess Refund, Free Look Cancellation or Withdrawal of proposal)
વર્તમાન નાણાકીય વર્ષ માટે કરવેરા ઘોષણા (વધારાના રિફંડ, ફ્રી લુક રદીકરણ અથવા પ્રસ્તાવ પાછો ખેંચ્યા સિવાયના)

1. Are you a tax resident of any country other than India as per the Income-tax Act, 1961?
તમે આવકવેરા અધિનિયમ, 1961 મુજબ ભારત સિવાય અન્ય કોઈ દેશના કર નિવાસી છો?

Yes^ ☐ No^^ ☐
હા^ ના^^

^To be ticked if you are a tax resident in India under the Income-tax Act, 1961.

^જો તમે આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ ભારતમાં કર નિવાસી છો, તો તેને ટીક કરવું.

^^If you are a non-resident in India as per the Income-tax Act, 1961, you are mandatorily required to submit Tax Residency Certificate (TRC) with Form 10F to avail treaty benefits, otherwise tax will be deducted at source at a higher rate from policy payouts. As per section 195 of the Income-tax Act, 1961, tax will be deducted at source from any payout to a non-resident at the rate applicable therein and subject to the conditions specified therein. Tax laws are subject to change.

^^જો તમે આવકવેરા અધિનિયમ, 1961 મુજબ ભારતમાં બિન-રહેવાસી છો, તો તમારે સંધિ લાભ મેળવવા માટે ફોર્મ 10 એફ સાથે ટેક્સ રેસીડેન્સી સર્ટિફિકેટ (ટીઆરસી) ફરજિયાતપણે સબમિટ કરવું પડશે, નહીં તો સોત પર પોલિસીની ચૂકવણીઓમાંથી ઊંચા દરે કર કાપવામાં આવશે. આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 195 મુજબ, કોઈપણ ચૂકવણીમાંથી બિન-નિવાસીને તેમાં ઉલ્લેખિત શરતોના આધીન અને લાગુ કરેલા દરે કર બાદ કરવામાં આવશે. કરવેરા કાયદાઓ ફેરફારના આધીન છે.

2. Is your total taxable income for the current financial year (April 1 to March 31):
શું વર્તમાન નાણાકીય વર્ષ (એપ્રિલ 1 થી માર્ચ 31) માટે તમારી કુલ આવક કરપાત્ર છે:

a) Less than or equal to INR 50 lakhs?
ભારતીય રૂપિયા 50 લાખ કરતા ઓછી અથવા તેના સમાન છે?

b) Greater than INR 50 lakhs but less than or equal to INR 1 crore?
ભારતીય રૂપિયા 50 લાખ કરતા વધારે પરંતુ ભારતીય રૂપિયા ૧ કરોડ થી ઓછી અથવા તેના સમાન છે?

c) Greater than INR 1 crore?
ભારતીય રૂપિયા 1 કરોડ કરતા વધારે છે?

3. Self-attested documents submitted: ☐ TRC ☐ FORM 10F
સબમિટ કરેલા સ્વ-પ્રમાણિત દસ્તાવેજો: ટીઆરસી ફોર્મ 10 એફ

Customer Acknowledgement Copy (UL Partial Withdrawal Form)

ગ્રાહક સ્વીકૃતિ કોપી (યુએલ પાર્શિયલ વિથડ્રોઅલ ફોર્મ)

Call 1860-267-9999 (local charges apply). DO NOT prefix any country code e.g. +91 or 00. Available Mon-Sat from 10 am to 7 pm | Email – service@hdfclife.com | nriservice@hdfclife.com (For NRI customers only) Visit – www.hdfclife.com

1860-267-9999 પર અમારો સંપર્ક કરો (સ્થાનિક ચાર્જ લાગુ). આગળ કોઈપણ દેશનો કોડ ના લગાડો દા.ત. +91 અથવા 00. સોમવાર-શનિવાર સવારે 10 થી સાંજના 7 સુધી ઉપલબ્ધ | ઇમેઇલ કરો - service@hdfclife.com | nriservice@hdfclife.com (ફક્ત એનઆરઆઇ ગ્રાહકો માટે) | મુલાકાત લો - www.hdfclife.com



Visit https://twitter.com/hdfclife_cares?lang=en and drop us a direct message or #AskNeo @HDFCLife_Cares https://twitter.com/hdfclife_cares?lang=en ની મુલાકાત લો અને અમને સીધો સંદેશ મોકલો અથવા #AskNeo @HDFCLife_Cares



Visit <https://simplychat.hdfclife.com/simplychat/> to Simply Chat સિમ્પલી ચેટ માટે <https://simplychat.hdfclife.com/simplychat/> ની મુલાકાત લો

HDFC Life
Sarutha ke jyo!

NOTE: નોંધ:

- A cancelled personalised cheque with account no. and IFSC should be submitted along with this NEFT Mandate. In case the cheque is not personalised, a latest bank statement or copy of passbook where account number and IFSC are mentioned needs to be submitted with the mandate.

ખાતા નંબર સાથે રદ કરેલ વ્યક્તિગત ચેક અને આઈએફએસસી કોડ આ એનઈએફટી મેન્ડેટ સાથે મોકલવું જોઈએ. જ્યાં ચેક વ્યક્તિગત નથી, ત્યાં ચેક નવીનતમ બેંક સ્ટેટમેન્ટ (૩ મહિનાથી વધુ જૂનું નહીં) અથવા પાસબુકની કોપી (જ્યાં ખાતા નંબર અને આઈએફએસસી કોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મેન્ડેટ સાથે મોકલવાની જરૂર છે.

- This mandate, upon processing, will override any of the previously tagged NEFT mandates for all policies, held by the client with HDFC Life.
- In case of NEFT failure or any further requirements pending on the mandate, payout will be kept on hold till a fresh NEFT mandate is received. We will inform you about the same.

જો એનઈએફટી નિષ્ફળ થાય છે અથવા મેન્ડેટ પરની કોઈપણ વધુ આવશ્યકતાઓ બાકી રહે છે, નવા એનઈએફટી મેન્ડેટ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચુકવણી અટકાવામાં આવશે. અમે તમને તેના વિશે જાણ કરીશું.

Declaration: ઘોષણા:

- I/We hereby declare that the particulars given above are correct. If the transaction is delayed or not effected at all for reason of incomplete or incorrect information provided by me/us above, I/we would not hold HDFC Life Insurance Company Limited or any of its associates/employees/agents responsible. Further, I/we agree to indemnify or keep indemnifying HDFC Life against any loss, claim, damage or expenses arising out of any incomplete or incorrect information provided by me/ us above.

હું/અમે અહીંથી જાહેર કરું છું/કરીએ છીએ કે ઉપર આપેલ વિગતો સાચી છે. જો ઉપરોક્ત મારા/અમારા દ્વારા પ્રદાન કરેલી અપૂર્ણ અથવા ખોટી માહિતીને કારણે સોદામાં વિલંબ થાય છે અથવા અસર નથી થતી, તો હું/અમે એચડીએફસી લાઇફ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ અથવા તેના કોઈપણ સહયોગી/કર્મચારીઓ/એજન્ટોને જવાબદાર ઠેરવીશ નહીં. વધુમાં, હું/અમે ઉપર મારા/અમારા દ્વારા પ્રદાન કરવામાં કરેલી કોઈપણ અપૂર્ણ અથવા ખોટી માહિતીને લીધે થતા કોઈપણ નુકસાન, દાવા, હાનિ અથવા તેના કારણે ઉદભવતા ખર્ચ સામે, એચડીએફસી લાઇફને ક્ષતિપૂર્તિ કરી આપવાની અથવા ક્ષતિપૂર્ણ કરવા માટે સંમત છું.

- I/We further undertake to refund any excess amount whether demanded by HDFC Life or not, which has been credited in excess to my/our account at any time due to any reason.

હું/અમે વધુમાં જો એચડીએફસી લાઇફ દ્વારા કોઈપણ વધારાની રકમ માંગવામાં આવેલી હોય કે નહીં, જે કોઈપણ કારણોસર થી કોઈપણ સમયે મારા/અમારા ખાતામાં વધુ રકમ જમા થાય છે તેને રિફંડ કરવાની બાંધકદારી આપું છું.

Date: DD/MM/YYYY
તારીખ:
Place: _____
સ્થળ:

SIGN HERE
અહીં સહી કરો

Signature of Account Holder
ખાતાધારકની સહી

Date: DD/MM/YYYY
તારીખ:
Place: _____
સ્થળ:

SIGN HERE
અહીં સહી કરો

Signature of Policyholder
(If policyholder is different from account holder)
પોલિસીહોલ્ડરની સહી
(જો પોલિસીહોલ્ડર ખાતાધારકથી અલગ હોય)

Declaration to be made by a third person where: ઘોષણા જે ત્રીજી વ્યક્તિ દ્વારા કરવામાં આવે જ્યાં:

The life assured has affixed his/her thumb impression / has signed in vernacular / has not filled the application. I hereby declare that I have explained the contents of this application form to the life to be assured in _____ language and have truthfully recorded the answers provided to me. I further declare that the life assured has signed/affixed his/her thumb impression in my presence.

જીવન વીમો કઢાવનારે છાપ/સ્થાનિક ભાષામાં સહી કરેલ છે/અરજી ભરી નથી. હું આથી જાહેર કરું છું કે મેં આ અરજી ફોર્મની સામગ્રીને _____ ભાષામાં જીવન વીમો કઢાવનારને સમજાવેલ છે અને મને પ્રદાન કરેલા જવાબોને સત્યતાથી રેકૉર્ડ કરેલ છે. હું વધુમાં જાહેર કરું છું કે જીવન વીમો કઢાવનારે મારી હાજરીમાં હસ્તાક્ષર કર્યા /તેના/તેણીના અંગૂઠાની છાપની મહોર મારી છે.

Call 1860-267-9999 (local charges apply). DO NOT prefix any country code e.g. +91 or 00. Available Mon-Sat from 10 am to 7 pm | Email – service@hdfclife.com | nriservice@hdfclife.com (For NRI customers only) Visit – www.hdfclife.com
1860-267-9999 પર કોલ કરો (સ્થાનિક ચુલક લાગુ). આગળ કોઈપણ દેશનો કોડ ના લગાડો દા.ત. +91 અથવા 00. સોમવાર-શનિવાર સવારે 10 થી સાંજના 7 સુધી ઉપલબ્ધ | ઇમેલ કરો- service@hdfclife.com | nriservice@hdfclife.com (ફક્ત એનઆરઆઇ ગ્રાહકો માટે) | મુલાકાત લો - www.hdfclife.com

Visit https://twitter.com/hdfclife_cares?lang=en and drop us a direct message or #AskNeo @HDFCLife_Cares
https://twitter.com/hdfclife_cares?lang=en ની મુલાકાત લો અને અમને સીધો સંદેશ મોકલો અથવા #AskNeo @HDFCLife_Cares

Visit <https://simplychat.hdfclife.com/simplychat/> to Simply Chat
સિમ્પલી ચેટ માટે <https://simplychat.hdfclife.com/simplychat/> ની મુલાકાત લો

HDFC Life
Sarutha ke jyo!

Declarant Name: _____

ડિક્લેરન્ટનું નામ:

Address: _____

સરનામું:

Date: DD/MM/YYYY Place: _____

તારીખ:

સ્થળ:

SIGN HERE

અહીં સહી કરો

Signature of Third Person

ત્રીજી વ્યક્તિની સહી:

HDFC Life Insurance Company Limited (HDFC Life).

CIN: L65110MH2000PLC128245. IRDAI Registration No. 101.

Regd. Off: 13th Floor, Lodha Excelus, Apollo Mills Compound, N.M. Joshi Marg, Mahalaxmi, Mumbai - 400 011.

એચડીએફસી લાઇફ ઇન્શ્યુરન્સ કંપની લિમિટેડ (એચડીએફસી લાઇફ).

સીઆઇએન: L65110MH2000PLC128245. આઇઆરડીએઆઇ નોંધણી નં. 101.

રજીસ્ટર્ડ ઓફિસ: 13મો માળ, લોઢા એક્સલસ, અપોલો મિલ્સ કંપાઉન્ડ, એન.એમ. જોશી માર્ગ, મહાલક્ષ્મી, મુંબઈ - 400 011.

Page 5-5

Customer Acknowledgement Copy (UL Partial Withdrawal Form)

ગ્રાહક સ્વીકૃતિ કૉપી (યુએલ પાર્શિયલ વિથડ્રોઅલ ફોર્મ)

Policy No.: _____ Interaction ID No.: _____ Policyholder name: _____

પોલિસી નં.: _____ ઇન્ટરેક્શન આઈડી: _____

પોલિસીહોલ્ડરનું નામ :

Documents accepted (specify): _____

સ્વીકૃત દસ્તાવેજો(સ્પષ્ટ કરો) :

Customer Relations Officer:

ગ્રાહક સંબંધ અધિકારી :

Date:

તારીખ:

Time:

સમય:

Branch Stamp
શાખાનું સ્ટેમ્પ

Note : If you have partially withdrawn from your funds or reduced the premium, please stay insured by paying your premiums regularly, failing which, the policy can be paid-up/cancelled. A policy can be cancelled if the fund value falls below its minimum threshold limit. Please refer to your policy document for details.

For queries or more information, call us on **1860-267-9999** (local charges apply). DO NOT prefix any country code e.g. +91 or 00. Available on Mon-Sat from 10 am to 7 pm | Email - service@hdfclife.com | nriservice@hdfclife.com (For NRI customers only) | Visit - www.hdfclife.com

નોંધ: જો તમે તમારા ફંડમાંથી આંશિક ઉપાડ કર્યું હોય અથવા પ્રીમિયમનો ઘટાડો કર્યો હોય, તો તમને તમારા પોલિસી પ્રીમિયમની ચુકવણી દ્વારા વીમાકૃત રહેવાની વિનંતી છે જો તમે આમ કરવામાં નિષ્ફળ રહો છો, તો તમારી પોલિસી પેડ-અપ/રદ થશે. જો ફંડનું મૂલ્ય તેની ન્યૂનતમ કગારની મર્યાદાથી નીચે જાય છે તો પોલિસી રદ કરી શકાય છે. કૃપયા વિગતો માટે તમારી પોલિસીના દસ્તાવેજનો સંદર્ભ લો.

1860-267-9999 પર કોલ કરો(સ્થાનિક ચાર્જ લાગુ). આગળ કોઈપણ દેશનો કોડ ના લગાડો દા.ત. +91 અથવા 00. સોમવાર-શનિવાર સવારે 10 થી સાંજના 7 સુધી ઉપલબ્ધ | ઇમેલ કરો- service@hdfclife.com | nriservice@hdfclife.com (ફક્ત એનઆરઆઇ ગ્રાહકો માટે) | મુલાકાત લો - www.hdfclife.com